

[52/A-22]

E+G

SARDAR PATEL UNIVERSITY No. of Printed Pages : 4

S. Y. B.Sc. Examination: SEMESTER - III

SEAT No. \_\_\_\_\_

COURSE: PHYSICS CODE: US03CPHY01

## COURSE TITLE: OPTICS

Date: 22/11/2018 / Thursday

Time: 2:00 to 5:00 PM

Total Marks: 70

## Q-1 Answer the following multiple choice questions: (All questions are compulsory) [10]

1. A lens which satisfies conditions  $\frac{\sin \theta_1}{\sin \theta_2} = \text{const}$  and  $\frac{\mu_1}{\mu_2} = \text{const}$  is known as \_\_\_\_\_.  
 (a) Convex lens    (b) Concave lens    (c) Aplanatic lens    (d) Anastigmate lens.
2. Which of the following is a monochromatic aberration:  
 (a) Distortion    (b) Coma    (c) Astigmatism    (d) all of them
3. \_\_\_\_\_ eye piece is a negative eye piece  
 (a) Huygens    (b) Ramsden    (c) Gaussian    (d) Newton
4. Fresnel's Biprism works on the principle of \_\_\_\_\_.  
 (a) Phase splitting    (b) Wavefront splitting  
 (c) Frequency splitting    (d) Amplitude splitting.
5. N-slit diffraction belongs to \_\_\_\_\_ class of diffraction.  
 (a) Fresnel    (b) Michelson    (c) Fraunhofer    (d) None of these
6. For multiple beam interferometry the visibility of fringes depends upon \_\_\_\_\_ Coefficient.  
 (a) Refraction    (b) Absorption    (c) Transmission    (d) Reflection
7. "The tangent of polarising angle is equal to refractive index of medium" - is \_\_\_\_\_ law.  
 (a) Maul's    (b) Brewster's    (c) Nicol's    (d) Huygens
8. Calcite is an example of \_\_\_\_\_ crystal.  
 (a) Uiaxial    (b) Biaxial    (c) Triaxial    (d) Tetraaxial
9. If refractive index of the core of a single mode step index optical fibre is 1.55 than that of the cladding may be \_\_\_\_\_ of the following:  
 (a) 1.57    (b) 1.53    (c) 1.60    (d) 1.55
10. \_\_\_\_\_ angle is the maximum angle that an incident light ray can have relative to the fibre axis and to propagate down to the fibre  
 (a) Critical    (b) Refracting    (c) Acceptance    (d) Propagation

## Q-2 Answer the following questions in short. (Any ten) [20]

- 1) Just enlist the cardinal points & planes of a lens system with diagram.
- 2) Explain the term "Aberration". State its types and sub-types.
- 3) Give merits and demerits of Ramsden's eyepiece.
- 4) Draw and explain the experimental arrangement for obtaining Newton's Rings.
- 5) Give two points of comparison of Biprism and Lloyd's Mirror.
- 6) Very briefly explain the types of diffraction with neat diagrams.
- 7) Using Brewster's law show that the reflected and refracted rays are at right angles.
- 8) Define isotropic and anisotropic materials with examples.
- 9) Define elliptically and circularly polarized lights.
- 10) Briefly explain the structure of a common optical fibre.
- 11) Mention any four advantages of optical fibre.
- 12) Classify the optical fibre based on refractive index profile and give their brief description.

**Q-3** For combination of two thin lenses derive the equations for equivalent focal length and all the cardinal points. [10]

**OR**

**Q-3** Explain in detail Huygens eyepiece along with its cardinal points and derive necessary equations. [10]

**Q-4** (a) Explain construction, experimental arrangement and working of Fresnel Biprism. [06]  
(b) Explain the construction and working of Fabry-Perot Interferometer and Etalon. [04]

**OR**

**Q-4** Describe Fraunhofer Double slit experiment. With necessary equations discuss about interference maxima and minima obtained in this experiment. [10]

**Q-5** (a) Explain construction and working of Nicol Prism. [06]  
(b) Briefly explain the construction and working of LCD. [04]

**OR**

**Q-5** (a) Explain the theory of superposition of waves linearly polarized at right angles.  
Discuss its special cases: (1)  $\delta = 0$  and (2)  $\delta = \pi/2$  [07]

(b) Prove that that the intensity of the transmitted polarized light is half of the incident unpolarised light intensity. [03]

**Q-6** (a) With a neat diagram derive the expression for the Acceptance angle for an optical fibre. [07]  
(b) Just draw a figure and derive the expression for Critical propagation angle for an optical fibre. [03]

**OR**

**Q-6** (a) Discuss in detail single mode and multimode step index fibre. [06]  
(b) Briefly discuss single and multi fibre cables with diagram. [02]

SEAT No. \_\_\_\_\_

દ્વિતીય વર્ષ પરીક્ષા: સેમેસ્ટર-૩

કોડ: ભૌતિકજ્ઞાન કોડ: US03CPHY01

કોર્સનું નામ: પ્રકાશજ્ઞાન (Optics)

તારીખ: ૨૨/૧૧/૨૦૧૮, ૩૩૧૧૨

સમય: ૨:૦૦ થી ૫:૦૦ PM

કુલ ગુણ: ૭૦

પ્રશ્ન-૧ નીચેના બહુવીકલ્પ પ્રશ્નોના જવાબ આપો: (બધા પ્રશ્નો ફરજીયાત છે)

[10]

1. જે લેન્સમાં શરતો  $\frac{\sin \theta_1}{\sin \theta_2} = \text{const}$  અને  $\frac{\mu_1}{\mu_2} = \text{const}$ , સંતોષાતી હોય તેને ..... કહેવાય.  
 (a) બાઈઓપ્ટિક (b) અંતગોળી (c) એપ્લેન્ટીક (d) એન્ઝેસ્ટીંગ્ટ
2. નીચેમાંથી કઈ એકવંશી ખામી છે:  
 (a) ડીસ્ટોર્શન (b) ક્રોમા (c) એસ્ટીંગ્મેટ્રીઝમ (d) બધા વિકલ્પ
3. ..... નેત્રકાચ એ જાણ નેત્રકાચ છે.  
 (a) હૃદયજ્ઞ (b) રામસ્કેન (c) ગોસીયન (d) ન્યૂટન
4. ફેનલ બાયપ્રિઝમ .....સિધ્યાંત પર કાર્ય કરે છે.  
 (a) ફેઝ શીફ્ટ વિભાજન (b) તરંગઅગ્ર વિભાજન (c) આવૃત્તિ વિભાજન (d) કંપવિસ્તાર વિભાજન
5. N-રિસ્ટ વિરતન .....વળનું વિરતન છે.  
 (a) ફેનલ (b) માઈક્રોસ્કોપ (c) ફોનાલોફર (d) એક પણ નહીં
6. મલ્ટીપલ બિમ ઈટરફેરોમેટ્રી માટે પ્રયોગ (visibility) .....ગુણાંક પર આધાર રાખે છે.  
 (a) વક્કિભવન (b) શોષણ (c) પારગમન (d) પરાવતન
7. “ધૂવિભવન કોણનો ટેન્જન એ માધ્યમના વક્કિભવનાં જેટલો હોય છે” - આ ..... નો નિયમ છે.  
 (a) માલુ (b) ધૂસ્ટર (c) નીકોલ (d) હૃદયજ્ઞ
8. કેલ્સાઇટ એ ..... સ્ફોટીકનું ઉદાહરણ છે.  
 (a) એક્સ્પ્રોક્ષિય (b) દિઅસ્ટ્રિય (c) નિઅસ્ટ્રિય (d) ચારાયકિય
9. જો એક સીંગલ-મોડ સ્ટેપ ઈન્ટેક્શન એપ્ટિકલ શાઈબરના કોરનો વક્કિભવનાં 1.55 હોય તો કલેરીગનો નીચેમાંથી ..... હોય શકે.  
 (a) 1.57 (b) 1.53 (c) 1.60 (d) 1.55
10. ..... કોણ એ આપાત પ્રકાશ કિરણને શાઈબર અસાની સાપેક્ષ શાઈબરમાં પ્રસરવા માટેનો મહત્વાંનો કોણ છે.  
 (a) ક્રોની (b) વક્કિભવન (c) એસેટન્સ (d) પ્રસરણ

પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. (કોઈ પણ દસ)

[20]

- 1) લેન્સતંત્રના કાર્યાલાયનું & સમતલોની આકૃતિ સાથે માત્ર યાદી આપો.
- 2) “ખામી - aberration” પદ સમજાવો. તેના પ્રકાર અને પેટા પ્રકાર જણાવો.
- 3) રામસ્કેન નેત્રકાચના સારા અને ખરાબ પાસાઓ આપો.
- 4) ન્યૂટનના વલયો મેળવવા માટેની પ્રાયોગિક ગોઠવણી દોરો અને સમજાવો.
- 5) બાયપ્રિઝમ અને લોઈડના અવિસાની સરખામશીનાં બે મુદ્દાઓ આપો.
- 6) સ્વચ્છ આકૃતિ વડે ધૂબ સંક્ષિપ્તમાં વિરતનના પ્રકારો સમજાવો.
- 7) ધૂસ્ટરના નિયમની મદદથી બલાવો કે પરાવર્તિત અને વક્કિભૂત કિરણો કાટખૂણે હોય છે.
- 8) સમાદિગધર્મી (isotropic) અને વિસમાદિગધર્મી (anisotropic) પદાર્થોની ઉદાહરણ સાથે વ્યાખ્યા આપો.
- 9) દિર્ઘવૃત્તિ અને વર્તુળમય ધૂવિભૂત પ્રકાશ વ્યાખ્યાયીત કરો.
- 10) સાદા ઓફ્ટિકલ શાઈબરની રચના સંક્ષિપ્તમાં સમજાવો.
- 11) એપ્ટિકલ શાઈબરના કોઈ પણ ચાર ફાયદા જણાવો.
- 12) વક્કિભવનાં પ્રોફાઈલ આધારીત એપ્ટિકલ શાઈબરનું વળાકરણ કરી તેમનું સંક્ષિપ્ત વિવરણ આપો.

(3)

(P.T.O.)

પ્રશ્ન-૩ બે પાતળા લેન્સના જોડકાં માટે તેની સમતુલ કેન્દ્રલંબાઈ અને તમામ કાર્ડિનલ બિંદુઓના સમીકરણો તારવો. [10]

OR

પ્રશ્ન-૩ હ્યુજન નેત્રકાચ તેના કાર્ડિનલ બિંદુઓ સહિત વિગતવાર સમજાવી જરૂરી સમીકરણો તારવો. [10]

પ્રશ્ન-૪ (a) ફેનલ બાયપ્રિઝમની રચના, પ્રાયોગિક ગોઠવણી અને કાર્ય સમજાવો. [06]  
(b) ફેલ્ટી-પેરોટ ઇન્ટરફેસિટર અને ઇટાલોનની રચના અને કાર્ય સમજાવો. [04]

OR

પ્રશ્ન-૪ ફોનાઇફરનો બે-લિસ્ટનો પ્રયોગ વર્ણવો. જરૂરી સમીકરણો સાથે આ પ્રયોગમાં મળતાં વાતિકરણ મહત્વમો અને ન્યૂનતમોની ચર્ચા કરો. [10]

પ્રશ્ન-૫ (a) નીકોલ પ્રિઝમની રચના અને કાર્ય સમજાવો. [06]  
(b) સંક્ષિપ્તમાં LCD ની રચના અને કાર્ય સમજાવો. [04]

OR

પ્રશ્ન-૫ (a) રેખીય લંબ-દ્વારિભૂત પ્રકાશના સંપત્તિકરણનો વાદ સમજાવો. ખાસ છિસ્સાઓ:  
    (1)  $\delta = 0$  અને (2)  $\delta = \pi/2$  ચર્ચો [07]  
(b) સાધિત કરો કે પારશમીત દ્વારિભૂત પ્રકાશની તીવ્રતા આપાત અદ્ભુતિ પ્રકાશની તીવ્રતા કરતા અડવી હોય છે. [03]

પ્રશ્ન-૬ (a) સ્વચ્છ આકૃતિ વડે એક ઓપ્ટિકલ શાઈબરના ઓસેપન્સ કોણનું સૂત્ર તારવો. [07]  
(b) ભાત્ર આકૃતિ દોઢી ઓપ્ટિકલ શાઈબર માટે કાત્તિ પ્રસરણ કોણનું સૂત્ર તારવો. [03]

OR

પ્રશ્ન-૬ (a) સીગલમોડ અને મલ્ટીમોડ સ્ટેપ ઇન્ટેક્શન શાઈબરની વિગતે ચર્ચા કરો. [06]  
(b) આકૃતિ સાથે સીગલ અને મલ્ટી શાઈબર કેબલની સંક્ષિપ્ત ચર્ચા કરો. [04]

—X—  
④